

દિવસે મજૂરીકામ વેળા રેકી કર્યા બાદ રાત્રે ચોરી કરતી ટોળકીના બે પકડાયા

તા.૦૧/૦૩/૨૦૧૭

દિવસે મજૂરી કામ વેળા રેકી કર્યા બાદ રાત્રે ચોરી કરતી મજૂરોની ગેંગના બે સાગરીતોને કાઠમ બ્રાંચે યોગીચોક પાસેથી પકડી પાડયા હતા. આ ટોળકી મોબાઇલની દુકાનોમાં હાથફેરો કર્યા બાદ સ્થાનિક વિસ્તારની બાઇકો પણ ચોરી જતી હતી. પોલીસે ૬૪ મોબાઇલ અને ૮ વાહનો કબજે કર્યા છે. આ સાથે શહેરની ૪ ઘરફોડ અને ૧૦ વાહન ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.

કાઠમ બ્રાંચના પી.એસ.આઇ. એમ.એસ.ત્રિવેદી અને તેમની સ્કવોડે વરાછામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્કવોડના પોલીસકર્મીઓ સત્યપાલસિંહ અને વિજય બહાદુરને બાતમી મળી હતી કે બે રીઢા ચોર યોગીચોક પાસેથી પસાર થવાના છે. જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી બાઇક પર પસાર થતા મતિયાસ રૂસમલ બબારિયા (ઉ.વ.૨૦ રહે.રાજ ભરવાડની ચાલ, દિવાળીબાગ નગર, સીમાડા-મુળ જાંબુઆ, મધ્યપ્રદેશ) અને મનીષ ઉર્ફે મન્યો માનસીંગ ડીડોર (ઉ.વ.૨૧ રહે. રાજ ભરવાડની ચાલ, સીમાડા-મુળ બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડી બંનેની અંગઝડતી લેતા તેઓ પાસેથી અલગ-અલગ કંપનીના ૧૦ મોબાઇલ, ૧-રેડીયો એમપી થ્રી પ્લેયર મળી આવ્યા હતા. કાઠમ બ્રાંચે કરેલી પૂછપરછમાં શહેરની ઘરફોડ અને વાહન ચોરીના ભેદ ઉકેલાઇ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મજૂરોની આ ટોળકીએ છેલ્લા બે મહિનામાં શહેરમાં ઠેક-ઠેકાણે મોબાઇલની દુકાનોમાં કસબ અજમાવ્યો છે. જ્યાં મજૂરી કામ કરવા જાય ત્યાં દિવસ દરમિયાન રેકી કરે છે અને બાદમાં રાત્રે ચોરી કરે છે. માથે યાદર ઓઢી દુકાનનું શટર ઉંચુ કરી ચોરી કરે છે. મોબાઇલ શોપમાં હાથ અજમાવી લીધા બાદ તે વિસ્તારમાં જે વાહન મળે તેની પણ ચોરી કરવામાં માહેર છે. માસ્ટર ચાવીને કારણે તેઓ બાઇક ચોરી જતા હતા.

તેઓએ ચોરીના ૬૪ મોબાઇલ ઘરે સંતાડયા હતા. તેમજ બાઇક પૂણા-સીમાડા કેનાલ રોડ પર મહારાજા ફાર્મની પાછળના ભાગે સંતાડી હતી. કાઠમ બ્રાંચે ૬૪ મોબાઇલ અને ૮ બાઇક મળી કુલ્લે રૂપિયા ૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે લીમ્બાયત, ચોકબજાર, કતારગામ અને ખટોદરા, પોલીસમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના તેમજ ખટોદરા, લીમ્બાયત, ડીડોલીની ૨-૨, કતારગામ-અમરોલી-સરથાણા અને પલસાણાની ૧- વાહનચોરીના ભેદ ઉકેલાઇ ગયા હતા.